

ત્વરિત જાહેરાત માટે

ઓન્ટેરિયો ગવર્મેન્ટે સ્થાનિક એસેસમેન્ટ સેન્ટર્સમાં પરીક્ષણ ક્ષમતા વધારી છે ત્યારે સીટી ઓફ બ્રેમ્પટને પોતાના તમામ સીટી કર્મચારીઓને COVID-19 માટે પરીક્ષણ કરાવવા કહ્યું

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 25, 2020) – આજે, સીટી ઓફ બ્રેમ્પટન પોતાના તમામ સીટી કર્મચારીઓને પોતાના સ્થાનિક હેલ્થ યુનિટ મારફતે COVID-19 માટે પરીક્ષણ કરાવવા કહી રહ્યું છે. સીટી ભલામણ કરે છે કે COVID-19 નાં દર્દી સામે ઉઘાડા થયા હોવાનું અથવા તેઓના સંપર્કમાં આવ્યા હોવાનું માનતા હોય તેવા તમામ કર્મચારીઓએ પરીક્ષણ કરાવવું. આ વિનંતી ઓન્ટેરિયો ગવર્મેન્ટની વધારાની પરીક્ષણ ક્ષમતા પૂરું પાડવાના અને પરીક્ષણની વિનંતી કરનાર તમામ વ્યક્તિઓનું પરીક્ષણ કરાવવાના નિર્ણય પછી કરવામાં આવી છે.

પીલ પબ્લિક હેલ્થને ઓન્ટેરિયો હેલ્થનો નિર્દેશ મળ્યો છે કે તેઓ સ્થાનિક એસેસમેન્ટ સેન્ટરની મુલાકાત લેતી કોઈપણ વ્યક્તિનું પરીક્ષણ તાત્કાલિક શરૂ કરે અને કોઈને પણ પરીક્ષણ કરાવ્યા વગર પાછા ન જવા દે. પરીક્ષણ કરાવવા ઈચ્છતા રહેવાસીઓ પાસે ટેલીહેલ્થ ઓન્ટેરિયો, પ્રાઈમરી કેર કે પબ્લિક હેલ્થ દ્વારા એસેસમેન્ટ સેન્ટરની ભલામણ હોવાની જરૂરિયાત હવે બિલકુલ રહેતી નથી.

આપણું શહેર બ્રેમ્પટનમાં COVID-19 નો વળાંક સપાટ કરવામાં અને ફેલાવો રોકવામાં મદદરૂપ થવા શહેરની સગવડોમાં અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પર વધારાના સુરક્ષા ઉપાયો મારફતે, અને વિશાળ મેદનીને પ્રોત્સાહિત કરતા અથવા વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર રાખવાનું મુશ્કેલ બનાવતા કાર્યક્રમો અને સેવાઓ બંધ કરીને સક્રિયપણે પગલાઓ ભરી રહ્યું છે.

આરોગ્ય મંત્રાલય તમામ એસેસમેન્ટ સેન્ટર્સની યાદી [પ્રોવિન્સની વેબસાઈટ](#) પર મૂકશે, જે સ્થળો સહિત હશે, જેથી કરીને જાહેર જનતા અને કર્મચારીઓ એસેસમેન્ટ સેન્ટર્સ સહેલાઈથી શોધી શકે છે. આપણું શહેર વધારેલા પરીક્ષણો અને મોબાઈલ એસેસમેન્ટ માટે પ્રોવિન્સની ગવર્મેન્ટની કટિબદ્ધતાને આવકારે છે, અને શહેરની અનિવાર્ય અને નિર્ણાયક સેવાઓના કાર્યસ્થળોએ મોબાઈલ એસેસમેન્ટ સગવડમય બનાવવા સ્થાનિક હોસ્પિટલો સાથે કામ કરશે.

બ્રેમ્પટનના ટ્રેડ બોર્ડ અને ડાઉનટાઉન બ્રેમ્પટન BIA મારફતે, આપણું શહેર સ્થાનિક ધંધાઓને પ્રોત્સાહિત પણ કરશે, એ વિનંતી કરવા કે તાજેતરના અઠવાડિયાઓમાં ફરી ખુલેલા ધંધાઓમાં કાર્યરત કર્મચારીઓ પણ પરીક્ષણ કરાવવા આગળ આવે.

અવતરણો (ક્વોટ્સ):

“મેં ગઈકાલે પ્રીમિયર સાથે વાત કરી અને હું સમગ્ર પ્રોવિન્સમાં પરીક્ષણ ક્ષમતામાં વધારાથી પ્રોત્સાહિત થયો હતો. અમે ગવર્મેન્ટની વિનંતીને ધ્યાનમાં લઈ રહ્યાં છીએ કે લક્ષણરહિત લોકો COVID-19 માટે પરીક્ષણ કરાવે, જેથી કરીને બ્રેમ્પટન COVID-19 નો ફેલાવો રોકવાના હેતુસર સીટી કર્મચારીઓને પરીક્ષણ માટે વિનંતી કરીને ઓન્ટેરિયોમાં ઉદાહરણરૂપ બનવામાં આગેવાની કરે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 સામે પ્રતિક્રિયા કરવા આપણાં સ્થાનિક આરોગ્ય ભાગીદારો અને આપણાં મજૂર ભાગીદારો સાથે સહયોગ સાધી રહ્યું છે અને અમે જાણીએ છીએ કે વધારાના પરીક્ષણો બ્રેમ્પટનની વસ્તી પર, ખાસ કરીને આપણાં અનિવાર્ય અને નિર્ણાયક સેવા કર્મચારીઓ માટે આ વાઈરસનો પ્રભાવ ઘટાડવામાં ભૂમિકા ભજવી શકે છે. સાથે મળીને, આપણે વળાંક સપાટ કરવા અને ફેલાવો રોકવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

“આ મહામારી દરમિયાન સમગ્ર બ્રેમ્પટનમાં રહેવાસીઓને સ્થળાંતર કરાવતી એક નિર્ણાયક સેવા તરીકે, અમારા કાર્યકરો પોતાની નોકરીથી અને આગવી હરોળે મહેનતભરી કામગીરી કરી રહ્યાં છે. આપણે વળાંક સપાટ કરવા સાથે મળીને કાર્યરત છીએ ત્યારે, અમે અગમચેતીના ભાગરૂપે અમારા સભ્યોનું પહેલેથી સક્રિય બનીને પરીક્ષણ કરાવવા સાથે સંમત છીએ જેથી કરીને અમે તેઓને અને આપણાં ટ્રાન્ઝિટ ઉતારુઓને સુરક્ષિત રાખી શકીએ છીએ.”

- ફ્રેન્ક વાની (Frank Vani), પ્રમુખ, અમેલ્ગમેટેડ ટ્રાન્ઝિટ યુનિયન, લોકલ 1573

“અમારા પહેલી હરોળના કાર્યકરો જરૂરી પગલાઓ ભરી રહ્યાં છે જેથી કરીને અમે આ COVID-19 મહામારીને સીધેસીધા પહોંચી વળી શકતા હોવાની ખાતરી કરાવી શકાય. પ્રોવિન્સે પરીક્ષણ માટે વધારેલી ક્ષમતાને ધ્યાનમાં લેતા, અમે આપણાં સભ્યોને લક્ષણો ન હોય તો પણ પરીક્ષણ કરાવવા દૃઢપણે પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી કરીને અમે આ વાઈરસનો ફેલાવો ઘટાડી શકીએ છીએ.”

- પૉલ લેકમ્પ્ટે (Paul Lecompte), પ્રમુખ, બ્રેમ્પટન પ્રોફેશનલ ફાયર ફાઈટર્સ એસોસિએશન, લોકલ 1068

“અમારા સભ્યો આ પડકારભર્યા સમય દરમિયાન શહેરને સેવાઓ વિતરિત કરવા ફાળો આપવાનું ચાલુ રાખી રહ્યાં છે અને અમે અમારા સભ્યોને ઉકેલનો ભાગ બનવા પ્રોત્સાહિત કરી રહ્યાં છીએ જેથી કરીને આપણે વહેલામાં વહેલી તકે નિયમિત કામધંધા તરફ પરત ફરી શકીએ. વધારાનું પરીક્ષણ ઉપલબ્ધ થવાથી, અમે ભલામણ કરીએ છીએ કે સભ્યો પરીક્ષણ કરાવે જેથી કરીને આપણે COVID-19 સામે જીતવામાં આપણો ભાગ ભજવી શકીએ.”

- કેનેડિયન યુનિયન ઓફ પબ્લિક એમ્પ્લોઈસ, લોકલ 831

-30-

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca